

વેદના ઉદ્ભવ વિશેના વિવિધ મતો

ટેક્સ્લ યોગિતા એચ. - પી.એચ.ડી.સ્ટુડન્ટ, એમ.ટી.બી.આર્ટ્સ કોલેજ, સુરત, ગુજરાત, ભારત

Email - bhargavtandel137@gmail.com

પ્રસ્તાવના:

ભારતમાં વેદની અપૌરુષેય માન્યતા છે. વેદની અનેક ભાષાઓમાં 'અપૌરુષેય' વાક્ય તે વેદ એવી વ્યાખ્યા છે વેદના કોઈ કર્તા નથી. ઋષિઓ વેદના મંત્રના દ્રષ્ટા છે પરંતુ રચયિતા નથી. ધર્મ પોતનું સ્વરૂપ જે ઋષિઓ સમક્ષ પ્રગટ કર્યું તે 'સાક્ષાત્કૃતધર્માણ' ઋષિઓ કહેવાયા.

સાક્ષાત્કૃતધર્માત્મક ઋષયો બખૂય : | તે અવરેભ્ય

અસાક્ષાત્કૃતધર્મભ્ય : ઉપદેશેન મંત્રાન્સપ્રાદુઃ

અર્થાત്

" ધર્મનો સાક્ષાત્કાર કરનારા ઋષિઓ થઈ ગયા. તેમણે જેમને ધર્મનો સાક્ષાત્કાર નથી થયો તેવા બીજા મનુષ્યને ઉપદેશ દ્વારા વેદમંત્રો આપ્યા હતા .

આ રીતે વશિષ્ઠ, વામદેવ, ગુત્સમદ વગેરે ઋષિઓએ વેદમંત્રની રચના કરી છે. એમ ન કેહવાય પરંતુ વેદના મંત્ર દેવની કૃપાથી પ્રાપ્ત કરીને સામાન્ય માનવી સુધી પહોંચાડવામા તે કેવળ નિમિત્તમાત્ર બન્યા છે. શુદ્ધ અને સરળ હદ્યના ઋષિઓના મનયક્ષુ સમક્ષ વેદના મંત્રો સ્ફુર્યા અને જેવા સ્ફુર્યા એ જ સ્વરૂપમા તે જળવાયા. કુલ પરંપરા અને શિષ્ય પરંપરા દ્વારા યુગો સુધી એકધાર્યા સ્વરૂપે જળવાઈને આપણા સુધી આવ્યા આથી કોઈ કર્તા નથી વેદ અપૌરુષેય છે .

વેદ, બ્રાહ્મણગ્રંથો, ઉપનિષદ, મનુસ્મૃતિ, મહાભારત તેમજ પુરાણોમા વેદોની ઉત્પત્તિ માટે કેટલાક વિચારો બિજ્ઞ-બિજ્ઞ રૂપે રજુ થયા છે. જે નીચે મુજબ છે .

(૧) ઋગવેદમાં એક સ્થળ છે જ્યાં વેદોની ઉત્પત્તિનું વર્ણન આવે છે .

તસ્માત् યજ્જાત સર્વહૃત્: ઋચ : સામાનાજિજ્જરિ |

છન્દાસાજિજ્જરિ તસ્માત् યજુસ્તસ્માદ અજાયત ||

અર્થાત്

" સર્વાત્મક પુરુષના યજ્ઞમાંથી ઋચા અને સામ મંત્રો ઉત્પજ્ઞ થયા, યારે સંહિતાઓ આવી જાય છે. એમ કહી શકાય છે .

(૨) અર્થર્વવેદમાં એકથી વધુ સ્થળોએ ઋગવેદ વગેરેની ઉત્પત્તિની વાત આવે છે .

(૧) યસ્માદ ઋચો અપાતક્ષન યજુર યસ્માદ અપાકષન

સામાનયિસ્ય લોમાનાનિથર્વાઅંગીરસ્તરો મુખમ સ્કમ્ભં તં બરૂહકિતમઃ સ્વદિ એવ સ : |

અર્થાત്

તે સ્ક્રણના વિષયમાં કહો જેનાથી તેઓએ ઋગવેદના મંત્રોનું નિર્માણ કર્યું જેનાથી તેઓએ યજુર્વને બનાવ્યો અને સામ જેના રોમ છે. તથા અર્થર્વા અને અંગિરસના મંત્રો મુળ છે .

(२) स वो ऋगमयों अजायत तस्माद् ऋचो अजायन्त |

અર्थात्

વળી “ મંત્રોથી ઈન્દ્ર ઉત્પન્ન થયા અને ઋકમંત્રો ઈન્દ્રથી ઉત્પન્ન થયા ” એમ કહું છે .

(३) कालाद् ऋचः समभवम् यजुः कालाद् अजायत ||

अર्थात्

વળી “ કાળમાંથી ઋક અને કાળમાંથી જ યજુસની ઉત્પત્તિ થઇ.”

આમ અર્થવેદમાં એકથી વધુ સ્થળે વેદોની ઉત્પત્તિની વાત દર્શાવી છે .

(३)

શતપથ બ્રાહ્મણમાં કથા આવે છે કે આરંભમાં કેવળ પ્રજાપતિ હતા . તેઓને પ્રજનન કરવાની ઇચ્છા થઇ અને તપથી પૂઢ્યી , આકાશ અને અંતરિક્ષ ઉત્પન્ન કર્યા અને તેમાંથી અગ્નિ , વાયુ અને સુર્યને ઉત્પન્ન કર્યા અને અગ્નિથી ઋગવેદની , વાયુથી યજુર્વેદની અને સુર્યથી સામવેદની ઉત્પત્તિ થઇ .

(४) છંદોગ્ય ઉપનિષદમાં પણ આવી કથા છે તેમાં અગ્નિથી ઋગવેદની વાયુથી યજુર્વેદની અને સુર્યથી સામવેદની ઉત્પત્તિ બતાવી છે . પછી ઋચાઓથો ‘ ભૂ ’ યજુસ ‘ ભૂય ’ અને સામથી ‘ સ્વાની ઉત્પત્તિ થઇ .

(૫) વળી મનુસ્મૃતિ મુજબ -

अग्नवियुरवभियस्तु त्रयं ब्रह्म सनातनम् |

दूदोह यज्जसदिधयर्थे ऋग्यजुरसामलक्षणम् ||

અર્થात्

અગ્નિ , વાયુ અને સુર્યના દોહનમાંથી ઋગવેદ , સામવેદની રચના બ્રહ્માએ કરી છે

આમ અહી મનુસ્મૃતિ મુજબ વેદની ઉત્પત્તિ અગ્નિ , વાયુ અને સુર્યના દોહનથી દર્શાવી છે .

(૬) વળી તૈતિરીયબ્રાહ્મણ મુજબ -

वाग्क्षरं प्रथमजा ऋतस्य वेदानाम् मात्रा अभूतस्य नाभिः |

અર્થात्

“ વાણી એ અક્ષર , ઋતમાંથી પ્રથમ ઉત્પન્ન થનારી વેદોની માતા અને અમૃતની નાભિ છે ” એમ જણાવ્યું છે

(૭) બીજી બાજુ બૃહ્દારણ્યક ઉપનિષદમાં વેદો તેમજ અન્ય શાસ્ત્રોને ઉત્પન્ન થનાર નહિ , પરંતુ પરમાત્માના સ્વાસોચ્છવાસ તરીકે વર્ણવ્યા છે .

(૮) પુરાણોમાં વેદની ઉત્પત્તિની કથા અવકાશ અનુસાર ખુબ વિસ્તારથી કે સંક્ષિમતમાં વર્ણવી છે . વિષ્ણુપુરાણ , ભાગવતપુરાણ , માર્કિયપુરાણ , હરિવંશ વગેરેમાં વેદોને બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા માન્યા છે , તેમાંયે વિષ્ણુપુરાણ , ભાગવતપુરાણ , માર્કિયપુરાણમાં દર્શાવ્યું છે કે -

ऋग्यजुः सामाथवरवियानवेदोनपुरवादभिमिखे : |શત્ર

शस्त्रमजिया स्तुतसितोમ प्रायश्चरति व्यधात्कमात ||

અર્થાત्

બ્રહ્માએ પુર્વમુખથી ઋગવેદ, દક્ષિણમુખથી યજુર્વેદ, પશ્ચિમમુખથી સામવેદ અને ઉત્તરમુખ અથર્વવેદની રચના કરી.

(૮) મહાભારત મુજબ ભગવાન વિષ્ણુએ સરસ્વતી અને વેદોને પોતાના મનથી ઉત્પણ્ણ કરેલા બતાવ્યા છે.

સરસ્વતીશચ વેદાશવ મનસ : સસુજેડત્યુત :

અર્થાત્

અચ્યુત ભગવાન વિષ્ણુએ સરસ્વતી અને વેદોને પોતાના મનમાંથી ઉત્પણ્ણ કર્યા

સમાપન:

ઉપરની ચર્ચા પરથી ફલિત થાય છે કે વેદની ઉત્પત્તિ પુરુષમાંથી, ઈન્ડ્રમાંથી, મનુષ્ણના સ્વસોચ્છવાસમાંથી વાક્યમાંથી, પ્રજાપતિમાંથી, અગ્નિ પવન કે સુર્યમાંથી બ્રહ્માના મુખમાંથી કે વિષ્ણુના મનમાંથી થયેલી વર્ણવી છે. જે અસંગત લાગે છે. ક્ષીરનીર દૃષ્ટિથી વિચારીશું તો જણાશે કે આ બધા વર્ણનોમાં વેદની ઉત્પત્તિ દૈવી દર્શાવવાનો જ હેતુ છે. તે પછી ગમે તે દેવમાંથી કેહવાય. જગતનું પરમતત્ત્વ તો એક જ છે, બાકી તો તેને શું નામ આપવું તે બાબતે વિદ્વાનોમાં મતભેદ પ્રવૃત્તે છે.

પાદટીપ:

૧. મહર્ષિ યાસ્કાચાર્ય રચિત નિરૂકત, ૧ - ૨૦
૨. ઋગવેદ ૧૦ - ૬૦ - ૬
૩. અથર્વવેદ ૧૦ - ૬ - ૨૦
૪. અથર્વવેદ ૧૩ - ૪ - ૩૮
૫. અથર્વવેદ ૧૮ - ૫૪ - ૩
૬. શતપથ બ્રાહ્મણ ૧૧ - ૫ - ૮ - ૧
૭. છાદોગ્ય ઉપનિષદ ૪ - ૧૭ - ૧ અને ઐતરેય બ્રાહ્મણ ૫ - ૩૨ - ૩૪
૮. મનુસ્મૃતિ ૧ - ૨૩
૯. તૈતરિય બ્રાહ્મણ ૨ - ૮ - ૮૫
૧૦. બૃહદારણ્યક ઉપનિષદ ૪ - ૫ - ૧૦
૧૧. વિષ્ણુ પુરાણ ૧ - ૫ - ૫૪ થી ૫૭ ભાગ ૩ - ૧૨ - ૩૭
૧૨. મહાભારત ૬ - ૬૭ - ૬